

ઉધના, સીલીકોન શોપર્સમાં આવેલ ‘પટેલ મહેન્દ્ર સોમાભાઇ કું.’ આંગડિયા પેઢીના કર્મચારીને લુંટી લેવા જતા પહેલા જ ઘાડપાડુ ગેંગને ઝડપી પાડી, લાલગેટ પો.રે.માં નોંધાયેલ લુંટની કોશીષનો ગુનો તેમજ પાંડેસરા પો.રે.ની વાહન ચોરીનો ભેદ ઉકેલતી કાઇમ ધ્રાંચ, સુરત શહેર.

સુરત શહેર ખાતે બનેલ ઘાડ/લુંટ જેવા અનડિટેક્ટ ગંભીર ગુનાઓના ભેદ ઉકેલવા ડી.સી.બી.પો.રે.ના પોલીસ અધિ./માણસોએ વર્ક આઉટ શરૂ કરેલ દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે રાંદેર, ઝગડિયા ચોકડી, ઉપરથી આરોપીઓ. (૧) અભુત જ્ઞાતિ સોસાયટી ચૌહાણ, ઉ.વ.૨૬, રહે. પ્રશાંત સોસાયટી વિભાગ-૧, ઝઘડિયા ચોકડી, પાલનપુર જકાત નાકા, રાંદેર, સુરત. મુળ વતન-દામન નગલા, તા.પટીયાલી, થાના-સીકંદરપુર વેસ્ટ, ગંજદુવાલા, જ.કાસગંજ, ઉત્તરપ્રદેશ. (૨) રોનીત ઉર્ફે મોહીત ઉર્ફે વિશાલ તુલશી ચૌહાણ, ઉ.વ.૩૧, રહે, પ્રશાંત સોસાયટી વિભાગ-૧, ઝઘડિયા ચોકડી, પાલનપુર જકાતનાકા, રાંદેર, સુરત. મુળ વતન-૨૧૯, ૨૨૦, ગ્રાઉન્ડ ફ્લોર, પોકેટ-૪, સેક્ટર-૨૫, ૭, રોહીણી, દિલ્હી. (૩) પ્રિતેશ ઉર્ફે ટાયગર રામવિનોદ પરમાર, ઉ.વ.૨૩, રહે. ૨૦૬, રસરાજ સોસાયટી, ભાઠા, સુરત. મુળ વતન-ગામ-ગુરખ, તા.જ.મુરૈના, વ્વાલીયર, મધ્યપ્રદેશ. (૪) ઉદયવિરસીંહ ઉર્ફે પપ્પુ રાજબહાદુરસીંહ તોમર, ઉ.વ.૪૬, રહે. ઘર નંબર-૫૭૯, સત્યનારાયણ સોસાયટી, રચના સોસાયટી પાસે, કાપોદ્રા, સુરત. મુળ વતન-ગામ-તરસમા, તા.થાના-પોરસા, જ.મુરૈના, મધ્યપ્રદેશ. (૫) રવિ પ્રતાપસિંહ તોમર, ઉ.વ.૨૭, રહે. રામ રાજ્ય સોસાયટી, રાજુભાઇ ગોબરભાઇ ભરવાડના મકાનમાં, બીજા માળે, કાપોદ્રા, સુરત. મુળ વતન- ગામ-તરસમા, તા.થાના-પોરસા, જ.મુરૈના, મધ્યપ્રદેશ નાઓને પ્રાણઘાતક હથિયારો સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરૂદ્ધ ડી.સી.બી. પો.રે.પાર્ટ-એ-ગુ.ર.નંબર-૧૧૨૧૦૦૧૫૨૧૦૦૦૪/૨૦૨૦ ઇ.પી.કો.કલમ ૩૯૯, ૪૦૦, ૧૨૦બી તથા આર્મ્સ એક્ટ કલમ- ૨૫(૧-ક) તેમજ જ.પી.એક્ટ કલમ ૧૩૫ (૧) મુજબનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આરોપીઓ સાંજના સમયે આંગડિયા પેઢીનો કર્મચારી જોખમ લઇને નીકળે ત્યારે તેને રસ્તામાં આંતરી લુંટી લેવાનો પ્લાન બનાવી પ્રાણઘાતક હથિયારો જેમાં લોડેડ દેશી બનાવટનો તમંચો-૧, દેશી બનાવટની પિસ્તલ-૧, દેશી બનાવટનો તમંચો-૧ તેમજ કાર્ટ્રીઝ નંગ-૬ તેમજ મોટો ચપ્પુ -૧ તથા લાકડાના હાથા વાળી હથોડી-૧ ધારણ કરી તેમજ કાળા કલરની સેલોટેપ, નાયલોનની દોરીના ટુકડા તથા નાયલોન દોરીનો ગુણો-૧, તેમજ મરચાની ભુકીના પડીકા નંગ-૨ , મોબાઇલ ફોનો નંગ-૭ તેમજ ત્રણ જુદી જુદી મોટર સાયકલ ઉપર બેસી આવી રાંદેર ઝઘડિયા ચોકડી પાસે ગુનાને અંજમ આપવા જતા પહેલા ભેગા થયેલ આ વખતે કાઇમ ધ્રાંચની ટીમે મળેલ બાતમી હકીકત આધારે પાંચેય આરોપીઓને કુલે રૂ.૨,૦૨,૭૦૦/- ની મત્તા સાથે ઝડપી પાડેલ છે. આરોપીઓ પાસેથી કબ્જે લેવામાં આવેલ મોટર સાયકલો પૈકી ટી.વી.એસ. અપાચી મો.સા. નં.ઠા ૦૫ કમ ૭૪૫૦ કી.રૂ.૨૫,૦૦૦/- ના મત્તાની પાંડેસરા પો.રે.વિસ્તારમાંથી આજથી ત્રણ મહિના પહેલા ચોરી થયેલ મુદ્દામાલ પૈકીની મો.સા. છે. આમ કાઇમ ધ્રાંચની ટીમે આરોપીઓ વિરૂદ્ધ આર્મ્સ વેપનો સાથે ઘાડના ગુનાને અંજમ આપતા પહેલા ઝડપી પાડી લાલગેટ પો.રે.ની લુંટની કોશીષ તેમજ પાંડેસરા પો.રે.ની વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાંખેલ છે.

શોધાયેલ ગુનાઓ:-[૧] લાલગેટ પો.રે. ગુ.ર.નં.૧૧૨૧૦૦૧૫૨૧૦૦૦૪/૨૦૨૦ ઇ.પી.કો.કલમ ૩૯૩, ૩૯૪, ૧૧૪ મુજબ. [૨] પાંડેસરા પો.રે. ગુ.ર.નં. ૧૧૨૧૦૦૪૫૨૧૦૩૦૪/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબ.